

અમદાવાદ મ્યુનિસિપલ કોરોરેશન
મહાનગર સેવા સંદર્ભ
સરદાર પટેલ ભવન
આસ્ટોડીયા રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧



માહિતી(મેળવવાના) અધિકાર અધિનિયમ, ૨૦૦૫
પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર
(સને ૨૦૧૫)

ઇન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતુ
ફોન નં. ૨૫૩૮૧૮૧૧
અદ્દ. ૫૪૬, ૪૧૮, ૬૮૪, ૫૮૮

પ્રમાણપત્ર

- ૧: આથી પ્રમાણિત કરવામાં આવે છે કે, તા.૧-૫-૧૫ થી તા.૩૦-૪-૧૬ દરમાન મારા વહીવટી કાર્યક્રમ હેઠળની આ સાથેની યાદી મુજબના જાહેર સત્તામંડળો દ્વારા માહિતી અધિકાર અધિનિયમની કલમ: ૪ અંતર્ગત સ્વયં જાહેર કરવાની બાબતો “પ્રોએક્ટીવ ડીસ્કલોગર”(PAD) તૈયાર કરવામાં આવી છે. તેનું અમારા દ્વારા ઈન્સપેક્શન-કમ-ઓડીટ કરવામાં આવ્યું છે અને જે બાબતે ક્ષતિ જણાઈ હતી અગર તો અપૂરતી વિગતો જણાઈ હતી તેની પૂર્તતા કરાવવામાં આવી છે.
- ૨: તા.૦૧-૦૫-૨૦૧૫ ની સ્થિતિએ આ સાથેની યાદી મુજબના જાહેર સત્તામંડળોના “પ્રોએક્ટીવ ડીસ્કલોગર”(PAD) નું ઈન્સપેક્શન-કમ-ઓડીટ પૂર્ણ થઈ ગયેલ છે. તેનું પ્રમાણપત્ર મોકલી આપવામાં આવશે.

તારીખ: ૦૧/૦૫/૨૦૧૫

લેબર ઓફિસર મુખ્યમંથક: અમદાવાદ મ્યુનિ.કોપોરિશન, અમદાવાદ
અમદાવાદ મ્યુનિ.કોપોરિશન

એનેક્ષર-એ

(સામાન્ય વહીવટ વિભાગના તા. ૧.૫.૦૮ ના પરિપત્ર ક્રમાંક:- પીએડી-૧૦-૨૦૦૭-૩૩૫૩૬૪- આરટીઆઈ
સેલનું બિડાણ)

પ્રમાણપત્ર

આથી પ્રમાણિત કરવામાં આવે છે કે, મારી વડી કચેરી(પ્રોપર) તથા મારા વહીવટી કાર્યક્ષેત્રના આ સાથેની
યાદી મુજબના જાહેર સત્તામંડળો દ્વારા માહિતી અધિકાર અધિનિયમની કલમ: ૪ અંતર્ગત સ્વયં જાહેર કરવાની
બાબતો(પ્રોએક્ટીવ ડિસ્કોલોઝર) (P.A.D.) તૈયાર કરવામાં આવી છે તા.૦૧.૦૫.૨૦૧૫ ની સ્થિતિએ અધતન
કરવામાં આવેલ છે, જેનું અમારા દ્વારા માહે એપ્રિલ/ મે: ૨૦૧૫ દરમ્યાન ઇન્સપેક્શન-ક્રમ-ઓડીટ કરવામાં આવ્યું છે
અને જે બાબતે ક્ષતિ જણાઈ હતી અગર તો અપૂરતી વિગતો જણાઈ હતી તેની પૂર્તતા કરાવવામાં આવી છે.

૨. તા. ૧-૫-૨૦૧૫ ની સ્થિતિએ હવે કોઈ જાહેર સત્તામંડળોના પ્રોએક્ટીવ ડિસ્કોલોઝર (P.A.D.) નું
ઇન્સપેક્શન-ક્રમ-ઓડીટ બાકી રહેલ નથી.

તા. ૧/૫/૨૦૧૫

જાહેર માહિતિ અધિકારી
(આઈ.આર.)

એનેક્ષર-બી

(સામાન્ય વહીવટ વિભાગના તા.૦૧.૦૭.૨૦૧૧ ના પરિપત્ર ક્રમાંક:- પીએડી-૧૦-૨૦૦૭-૩૩૫૩૬૪-
આરટીઆઈ સેલનું બિડાણ)

આથી પ્રમાણિત કરવામાં આવે છે કે, માહિતી અધિકાર અધિનિયમની કલમ: ૪ અંતર્ગત સ્વયં જાહેર
કરવાની બાબતો પ્રોએક્ટીવ ડિસ્કોલોઝર (P.A.D.) મારા વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે અને તા. ૧-૫-
૨૦૧૫ ની સ્થિતિએ અમારી મંજૂરી મેળવી અધતન કરવામાં આવેલ છે.

તા. ૧-૫-૨૦૧૫

મુખ્ય મથક:- અમદાવાદ મ્યુ.કોરોરેશન
સરદાર પટેલ ભવન, અમદાવાદ-૧

લેબર ઓફિસર
ઇન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતુ

અનુક્રમણિકા

અનુક્રમ	વિષય	પાના
૧	ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાનું વહીવટી માળખું અને કામગીરી	૧ થી ૨
૨	ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાના અધિકારી/ કર્મચારીઓની ફરજો તથા સત્તાઓ	૩ થી ૬
૩	ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાના સ્ટાફની ડિરેક્ટરી	૭ થી ૮
૪	ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાના અધિકારી/ કર્મચારીઓના માસિક મહેનતાણા/ ભથ્થાંની વિગત	૧૦ થી ૧૧
૫	સફાઈ કામદારોના વારસદારોને રહેમરાહે નોકરી આપવાના નિયમો બાબત	૧૨
૬	ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતામાં નિર્ણય લેવામાં અનુસરવામાં આવતી પદ્ધતિ	૧૩
૭	પેન્ડિંગ ખાતાકીય તપાસની વિગતો	૧૪
૮	ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાનું મંજૂર થયેલ બજેટ	૧૫
૯	ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાના એપેલેટ, ઓથોરીટી, તથા જાહેર માહિતી અધિકારીની વિગત	૧૬

ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાનું વહીવટી માળખું અને કામગીરી

(૧) વહીવટી માળખું

(એ) કચેરીનું સ્થળ :- અમદાવાદ મહાનગર સેવા સંદર્ભ
સરદાર પટેલ ભવન, પ્રથમ માળે, “સી” બ્લોક
સેન્ટ્રલ ઓફિસની બાજુમાં, દાણાપીઠ, અમદાવાદ-૩૮૦ ૦૦૧

(બી) કચેરીનો સમય :- સવારના ૧૦:૩૦ થી ૬:૧૦ સુધી
(૨:૦૦ થી ૨:૩૦ રીસેસ)


(સી) ખાતાના વિભાગો:- મુખ્ય ચાર વિભાગમાં કામ કરે છે.
(૧) ખાતાનું એસ્ટાબ્લીશમેન્ટ
(૨) લેબર સેલ(લેબર કોર્ટની કામગીરી)
(૩) સફાઈ કામદારોના આશ્રિતોને નોકરી
(૪) ખાતાકીય તપાસ

વહીવટી માળખું

ડ.મ્યુનિ.કમિશનર(ઈન્ડસ્ટ્રીયલ રીલેશન)

લેબર ઓફિસર

આસી.મેનેજર(ઈન્ડસ્ટ્રીયલ રીલેશન)



ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાની મુખ્ય કામગીરી

- (૧) ભૂનિ.કોર્પોરેશનના તમામ ખાતાઓને મજૂર પ્રશ્નોમાં માર્ગદર્શન, સલાહ તથા અભિગ્રાહ્યો આપવા.
- (૨) ઈન્ડસ્ટ્રીયલ ટ્રીબ્યુનલ, લેબર કોર્ટ તથા લેબર કાયદાઓ નીચે રચાયેલ જુદી જુદી ઓથોરીટીઓ સમક્ષ દાખલ થયેલા કેસોનું સંકલન, ભૂનિ.કોર્પોરેશન તરફથી બચાવ કરવો, એડવોકેટોને માહિતી આપી જવાબો ફાઈલ કરાવવા.
- (૩) ઈન્ડસ્ટ્રીયલ ટ્રીબ્યુનલ તથા લેબર કોર્ટના એવોર્ડનો અમલ કરાવવો અથવા અપીલ કરવાની કામગીરી.
- (૪) મજૂર કમિશનરશીની કચેરીમાં ચાલતી કન્સીલીએશન કાર્યવાહીમાં રજુઆત કરવી, કન્ટ્રોલીંગ ઓથોરીટી તથા એપેલેટ ઓથોરીટી સમક્ષના ગ્રેજ્યુટીના કેસોની કામગીરી.
- (૫) યુનીયનોના પત્રો તથા રજુઆતો સ્વીકારવી અને સક્ષમ સત્તા પાસે નિશ્ચય કરાવવો તથા યુનીયનોના હોદ્દેદારો તથા ઓથોરીટીઓ સાથે મીટિંગનું આયોજન.
- (૬) હેલ્થ કોન્જરવન્સી, રેફ્યુઝ તથા ખાળકુવા ખાતાના કામદારોના મરણ તથા નોકરી દરમ્યાન (મેડિકલ તપાસમાં) અનફીટ થવાના પ્રસંગે તેમના વારસદારોને રહેમરાહે નોકરી આપવાની કામગીરી.
- (૭) ભૂનિ.કર્મચારીઓ તથા અધિકારીઓ વિરુધ્ધની ખાતાકીય તપાસની કામગીરી:- ચાર્જશીટ, શો કોઝ નોટિસ, શિક્ષાના હુકમોના ડ્રાફ્ટીંગ, શિક્ષાના હુકમો ઈસ્યુ કરવા તથા અમલ કરાવવાની કામગીરી.
- (૮) બી.પી.એમ.સી. એક્ટ, ૧૯૪૮ ની કલમ: ૫૬(૪) નીચે કર્મચારીઓએ સ્ટે.કમિટીને કરેલ અપીલની કાર્યવાહી તથા અપીલમાં સ્ટે.કમિટીએ કરેલ ઠરાવના અમલ.
- (૯) સર્વિસ મેટરમાં આવેલ હાઈકોર્ટ, સીટી સીવીલ કોર્ટ, તથા અન્ય કોર્ટના ચુકાદાઓના અમલીકરણ તથા અપીલની કામગીરી.
- (૧૦) વાલ્બિકી સમાજના કર્મચારીઓના પ્રશ્નો અંગે મીટિંગનું આયોજન.

સને ૨૦૧૫

ઇન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાના અધિકારી/ કર્મચારીની ફરજો તથા સત્તાઓ

અ.નં.	અધિકારી/ કર્મચારીનું નામ	હોદ્દો	સત્તાઓ			ફરજો/ કામગીરીની ટૂંકી વિગત
			વહીવટી	નાણાંકીય	અન્ય	
૧	ડૉ. નરેન જી. હજરી	લેબર ઓફિસર	ઇન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાની તમામ વહીવટી સત્તાઓ	રૂ. ૧૦૦૦/-	-	<ul style="list-style-type: none"> - ઇન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાની વહીવટી દેખરેખ, નિયંત્રણ તથા સુપરવીઝન - તમામ ખાતાઓને મજૂર પ્રશ્નોમાં સલાહ તથા માર્ગદર્શન આપવું. - ગુજરાત હાઈકોર્ટની સર્વિસ મેટરોની કામગીરી. - લેબર તથા ઇન્ડસ્ટ્રીયલ રીલેશન કામગીરી ઉપર દેખરેખ તથા સંકલન, સુપરવીઝન - સફાઈ કામદારોના વારસદારોને રહેમરાહે નોકરી આપવાની કાર્યવાહી - મજૂર પ્રશ્નોમાં વહીવટી અને નીતિ-વિષયક નિષ્ઠય લેવડાવવા.
૨	હાલમાં જગ્ગા ખાલી	આસી.મેનેજર	હાથ નીચેના સ્ટાફનું સુપરવિઝન અને દેખરેખ	-	-	<ol style="list-style-type: none"> ૧) તમામ ખાતાના કર્મચારીઓના સર્પેન્શનના હુકમની કાર્યવાહી ૨) તમામ ખાતાના વર્ગ-૧ તથા વર્ગ-૨ ના કર્મચારીઓની શોકોઝ નોટીસ, ચાર્ઝશીટ, ફાઈનલ શોકોઝ નોટીસ તથા હુકમો સંબંધીત કાર્યવાહી ૩) હાઈકોર્ટ એડવોકેટ સાથે સંકલનની કામગીરી ૪) રાજ્ય સરકાર સાથે થતા પત્ર વ્યવહાર અંગેની કાર્યવાહીની કામગીરી ૫) આર.ટી.આઈ.ને લગતી ખાતામાં આવતી તમામ અરજીઓ તથા ડે.ભ્યુનિ.કમિ. (આર.ટી.આઈ.)શ્રી નાં ઓફિસ ઓર્ડર નં. ૨ તા. ૧૬/૧૨/૧૩ મુજબની કાર્યવાહી કરવી. <p>તમામ ડે.ભ્યુનિ.કમિશનરશ્રીઓ સાથે કર્મચારીઓની સુનાવણી અંગેની કામગીરી</p>

૩	શ્રી તુલસીદાસ એસ.રાઠવા	સંકલન અધિકારી	ખાતાકીય તપાસ કચેરીના સ્ટાફનું સુપરવીઝન અને કામગીરી ઉપર દેખરેખ	-	-	૧) તમામ ખાતાના કર્મચારીઓની શોકોઝ નોટીસ, ચાર્જશીટ, ફાઈનલ શોકોઝ નોટીસ તથા હુકમો સંબંધીત કાર્યવાહી (બજવણી, કર્મચારીઓએ આપેલ જવાબ બાદની કાર્યવાહી) ૨) તમામ ડે.ભુનિ.કમિશરશ્રીઓ સાથે કર્મચારીઓની સુનાવણી અંગેની કામગીરી તથા તેને આનુષંગિક કાર્યવાહી
૪	શ્રી ગુલામનભી જ. શેખ	વેલફેર કમ લેબર ઓફિસર		-	-	૧) તમામ ખાતાના કર્મચારીઓના સર્પેન્શનના હુકમની કાર્યવાહી ૨) તમામ ખાતાના ઈન્ડસ્ટ્રીયલ ટ્રીબ્યુનલમાં ચાલતા કેસોની કામગીરી ૩) બી.પી.એમ.સી.એક્ટની કલમ-૫૮(૪) નીચે થતી અપીલને લગતી કાર્યવાહી ૪) હાઇકોર્ટ એડવોકેટ સાથે સંકલનની કામગીરી
૫	શ્રી અમરીષ ડી. જાની	વેલ્ફેર કમ લેબર ઓફિસર		-	-	૧) લેબર કમિશરની કચેરીમાં ચાલતા કન્સિલીએશનના કેસોની કામગીરી ૨) કંટ્રોલીંગ ઓથોરીટી, એપેલેટ ઓથોરીટી તથા મજૂર કાયદાઓ નીચે નિમાયેલ અન્ય ઓથોરીટીઓના કેસોની કામગીરી ૩) પશ્ચિમઝોન અને મધ્યઝોન હેલ્પ કોન્જરવન્સી ખાતાના સફાઈ કામદારોના મરણ અને અનફીટ થવાના પ્રસંગે આશ્રિતોને નોકરી આપવાની કામગીરી
૬	શ્રી સતીષચંદ્ર સી. પટેલ	વેલ્ફેર કમ લેબર ઓફિસર		-	-	૧) યુનીયનના પ્રશ્નો તથા સક્ષમ સત્તાઓ સમક્ષ યોજવામાં આવતી મીટિંગોની કામગીરી ૨) પૂર્વઝોન, ઉત્તરઝોન તથા દક્ષિણઝોનના હેલ્પ કોન્જરવન્સી ખાતાના સફાઈ કામદારોના મરણ અને અનફીટ થવાના પ્રસંગે આશ્રિતોને નોકરી આપવાની કામગીરી
૭	શ્રી દિલીપકુમાર સી.પંચાલ	વેલ્ફેર કમ લેબર ઓફિસર		-	-	૧) તમામ ખાતાના લેબર કોર્ટના કેસોની કામગીરી ૨) ભુનિ.કર્મચારી સામે દાખલ થતા તથા દાખલ કરવામાં આવતાં પોલિસ કેસ તથા એ.સી.બી.કેસોની કામગીરી ૩) સીટી સીવીલ કોર્ટ તથા હાઇકોર્ટમાં આઈ.આર.ખાતાને લગતાં કેસોની કામગીરી ૪) નવા પશ્ચિમઝોન હેલ્પ કોન્જરવન્સી ખાતાના મરણ અનફીટ થવાના પ્રસંગે આશ્રિતોને નોકરી આપવાની કામગીરી

૮	શ્રી લક્ષ્મણભાઈ વી. ખાટા	વેલ્કેર કમ લેબર ઓફિસર (સેન્ટ્રલ વર્કશોપમાંથી ફાળવણી)		-	-	૧) રીમુવલને લગતી કામગીરી ૨) તમામ ખાતાના વર્ગ-૩ તથા વર્ગ-૪ ના કર્મચારીઓની શોકોડ નોટીસ, ચાર્જશીટ, ફાઈનલ શોકોડ નોટીસ તથા હુકમો સંબંધીત કાર્યવાહી
૯	શ્રી વધબેન આર. ઓજા	ટાઇપિસ્ટ- કમ્પ્લાર્ક		-	-	- ખાતાકીય તપાસમાં આપવામાં આવતા ચાર્જશીટ, સસ્પેન્શન, ફાઈનલ શો કોડ નોટીસો, શિક્ષાના હુકમો કોમ્પ્યુટર ઉપર ટાઇપ કરવા. - ઈન્કવાયરી ઓફિસરોના રીપોર્ટ ટાઇપ કરવા. - ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાનું અન્ય કાગળોનું ટાઇપિંગ
૧૦	શ્રી મહેશકુમાર બી. પારેખ	જી.કો.ઓપરેટર		-	-	- ખાતાકીય તપાસના ચાર્જશીટ, શો કોડ નોટીસ, સસ્પેન્શન હુકમ, શિક્ષાના હુકમોના ડ્રાફ્ટ કોમ્પ્યુટર ઉપર ટાઇપ કરવા. - ઈન્કવાયરી ઓફિસરોના રીપોર્ટ ટાઇપ કરવા. - ખાતાની અન્ય ટાઇપિંગ કામગીરી
૧૧	શ્રી બ્રિજેશકુમાર જે. નાયક	સ્ટેનોગ્રાફર		-	-	- હાલમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર ખાતે ફાળવણીથી ફરજ બજાવે છે.
૧૨	શ્રી ભાનુપ્રસાદ જે. પટેલ	સીની.કલાર્ક		-	-	- ચાર્જશીટના ડ્રાફ્ટ ટાઇપ કરાવવા, કમ્પેર કરવા અને સક્ષમ સત્તા સમક્ષ એમુવલ માટે મુકવા - એમુવ થયેલ ચાર્જશીટના ડ્રાફ્ટ જેતે કર્મચારીને બજાવવા મોકલવા તથા ફાઈલ ઈન્કવાયરી ઓફિસરને મોકલવી
૧૩	શ્રી મયુરીબેન સી.પટેલ	સીની.કલાર્ક		-	-	- ઈન્કવાયરી ઓફિસરના રીપોર્ટ ઉપર સક્ષમ સત્તાએ શિક્ષા અંગે જે નિર્ણય લીધેલ હોય તેના અનુસંધાનમાં તૈયાર કરેલ શો કોડ નોટીસના ડ્રાફ્ટ ટાઇપ કરાવી સક્ષમ સત્તા સમક્ષ મુકવા - એમુવ થયેલ શો કોડ નોટીસ જેતે કસુરદાર કર્મચારીને ઈસ્યુ કરવી.
૧૪	હાલ જગ્યા ખાતી	સીની.કલાર્ક		-	-	- ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાના એસ્ટાબ્લિસમેન્ટની કામગીરી - ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાના સ્ટાફના પગાર તથા સર્વિસ કુકની જાળવણી - લેબર કોર્ટ, ઈન્ડસ્ટ્રીયલ ટ્રીબ્યુનલ કેસોના રજીસ્ટરોની જાળવણી તથા મેઝિનેન્સ - ખાતાના અન્ય પરચુરણ બીલોની કામગીરી

૧૫	શ્રી મૌનાબેન એ. પંડીત	સીની.કલાર્ક		-	-	<ul style="list-style-type: none"> - સેન્ટ્રલ ઓફિસ તથા વિજલન્સ ખાતા દ્વારા હાથ ધરવામાં આવતા સરપ્રાઈઝ ચેકીંગમાં ગેરહાજર માલુમ પડતા કર્મચારીઓને શો કોઝ નોટિસો તૈયાર કરવી, એપ્રુવ કરાવવી તથા ઈસ્યુ કરવી. - ઉપરોક્ત શો કોઝ નોટિસના ખુલાસાઓ મેળવવા અને સક્ષમ સત્તા સમક્ષ મુક્કી નિર્ણય કરાવવો. - શિક્ષાના હુકમો તૈયાર કરવા અને ઈસ્યુ કરવા - પ્રમોશન તથા કાયમ કરવા સમયે કર્મચારીઓને ખાતાકીય તપાસનું એન.ઓ.સી. આપવું.
૧૬	શ્રી ભીખાભાઈ એમ. પટેલ	સીની..કલાર્ક		-	-	<ul style="list-style-type: none"> - ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાના ખાતાકીય તપાસ કચેરીની ટપાલ લેવી, ઈન્વર્ક કરવી તથા જેતે અધિકારી સમક્ષ મુકવાની કામગીરી - દફ્તરે થતી ઈન્કવાયરી ફાઈલોની વર્ગીકરણ અને જાળવણી - આઈ.આર.ઇએસટી. ના હુકમો ઈસ્યુ કરવાની કામગીરી
૧૭	શ્રી કમલેશ એચ. પુરોહિત	સીની.કલાર્ક		-	-	<ul style="list-style-type: none"> - રાઇટ ટુ ઈન્ફોર્મેશન નીચેની અરજીની કામગીરી.
૧૮	શ્રી જેની બી. શાહ	જુનિ. કલાર્ક		-	-	<ul style="list-style-type: none"> - ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાના ઈન્કવાયરી સેલ સિવાયની તમામ ટપાલ લેવી, ઈન્વર્ક કરી લેબર ઓફિસરને મુકવી તથા ટપાલ આઉટવર્ક કરી જેતે ખાતાઓને મોકલવી. - બી.પી.એમ.સી. એકટની કલમ: પદ(૪) નીચે થતી અપીલની કામગીરી. - ઈન્કવાયરી ઓફિસરના પત્રો તથા ખાતાના અન્ય પત્રોના પોસ્ટ-રજ.પોસ્ટ એડી.ની કામગીરી
૧૯	શ્રી રમણભાઈ પી. શર્મા	પટાવાળા		-	-	<ul style="list-style-type: none"> - ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાની તમામ બહારના ખાતાઓના ટપાલની કામગીરી
૨૦	શ્રી ગોવિંદભાઈ પી. નાથી	પટાવાળા		-	-	<ul style="list-style-type: none"> - ખાતાકીય તપાસ કચેરીના પટાવાળાની કામગીરી અને ખાતાકીય તપાસને લગતી ફાઈલોની કામગીરી.
૨૧	શ્રી પોપટભાઈ છ. વાધેલા	પટાવાળા		-	-	<ul style="list-style-type: none"> - લેબર ઓફિસરની મુખ્ય ઓફિસે પટાવાળાની કામગીરી
૨૨	શ્રી જસપાલ રતનલાલ રોત	પટાવાળા		-	-	<ul style="list-style-type: none"> - ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાની અંદરના ખાતાઓની ટપાલની કામગીરી
૨૩	શ્રી પોપટભાઈ બી. રાવળ	પટાવાળા		-	-	<ul style="list-style-type: none"> - ઈન્કવાયરી ઓફિસરો પાસે પટાવાળાની કામગીરી

★ શ્રી લક્ષ્મણભાઈ વી. ખાતા, , શ્રી મહેશકુમાર બી.પારેખ, શ્રી વર્ષાબેન આર. ઓજા, શ્રી મયુરીબેન સી.પટેલ તથા શ્રી જેની બી. શાહનો પગાર આઈ.આર. ખાતેથી નીકળતો નથી.

ઇન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાના સ્ટાફની ડિરેક્ટરી

અ. નં.	એમ્પલોઈ નંબર	નામ	હોદ્દો	ફોન નંબર			ફેક્સ	ઈ-મેઈલ
				ક્રેચી	મોબાઈલ	ધર		
૧	૮૩૭૫	ડૉ. નરેન જી. હજારી	લેબર ઓફિસર	૨૫૩૮૯૮૯૯ (એક્ષ. ૫૪૬ અને ૪૧૮)	૯૩૨૭૦૩૮૭૭૩	૦૭૯-૨૫૩૮૪૭૪૪		narenhajari@egovamc.com
૨	-	હાવમાં જગા ખાલી છે.	આસી. મેનેજર	૨૫૩૮૯૮૯૯ (એક્ષ. ૫૮૮)				
૩	૧૦૫૬	શ્રી તુલસીદાસ એસ. રાઠવા	સંકલન અધિકારી	૨૫૩૮૯૮૯૯ (એક્ષ. ૬૮૪)				
૪	૬૭૬૩	શ્રી ગુલાબનથી જી. શેખ	ઉભાયુ.એલ ઓ.	૨૫૩૮૯૮૯૯ (એક્ષ. ૪૧૮)	૯૩૨૮૩૮૫૫૬૪			
૫	૮૩૮૧	શ્રી અમરિષ ડી. જાની	ઉભાયુ.એલ ઓ	૨૫૩૮૯૮૯૯ (એક્ષ. ૪૧૮)	૯૩૨૮૩૮૫૫૬૫			
૬	૬૨૩૮	શ્રી સતીષ સી. પટેલ	ઉભાયુ.એલ ઓ	૨૫૩૮૯૮૯૯ (એક્ષ. ૪૧૮)	૯૩૨૮૩૮૫૫૬૬			
૭	૮૭૦૫	શ્રીદિલીપ કુમાર સી. પંચાલ	ઉભાયુ.એલ ઓ	૨૫૩૮૯૮૯૯ (એક્ષ. ૪૧૮)	૯૩૨૭૦૩૮૭૮૪			
૮	૮૫૨૭	શ્રી લક્ષ્મણભાઈ વી. ખાટા	ઉભાયુ.એલ ઓ	૨૫૩૮૯૮૯૯ (એક્ષ. ૪૧૮)	૯૩૨૭૦૩૮૮૪૩			
૯	૪૮૫૬	શ્રી વધાબિન આર. ઓળા	ટાઈપીસ્ટ કમ કલાર્ક	૨૫૩૮૯૮૯૯ (એક્ષ. ૬૮૪)				

૧૦	૭૨૧૫૩	શ્રી મહેશકુમાર બી. પારેખ	જૂ.કો. ઓપરેટર	૨૫૩૮૯૮૯૯ (એક્ષ. ૬૮૪)				
૧૧	૭૨૦૮૭	અંજેશકુમાર જે. નાયક	સ્ટેનો	૨૩૨૫૧૦૧૪ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ, ગાંધીનગર				
૧૨	૭૮૨૫	શ્રી ભાનુપ્રસાદ જે. પટેલ	સીની.કલાર્ક	૨૫૩૮૯૮૯૯ (એક્ષ. ૬૮૪)				
૧૩	૭૬૭૨	શ્રી મૌનાબેન એ. પંડીત	સીની.કલાર્ક	૨૫૩૮૯૮૯૯ (એક્ષ. ૬૮૪)				
૧૪	૬૮૪૮	શ્રી મધુરી સી. પટેલ	સીની.કલાર્ક	૨૫૩૮૯૮૯૯ (એક્ષ. ૬૮૪)				
૧૫	૭૮૨૭	શ્રી ભીખાભાઈ એમ. પટેલ	સીની.કલાર્ક	૨૫૩૮૯૮૯૯ (એક્ષ. ૬૮૪)				
૧૬	૮૬૮૭	કમલેશભાઈ એચ. પુરોહિત	સીની.કલાર્ક	૨૫૩૮૯૮૯૯ (એક્ષ. ૬૮૪)				
૧૭	૮૩૮૨	શ્રી જૈનીબેન બી. શાહ	જૂની. કલાર્ક	૨૫૩૮૯૮૯૯ (એક્ષ. ૬૮૪)				
૧૮	૩૪૦૮૨	રમણભાઈ પી. શર્મા	પટાવાળા	૨૫૩૮૯૮૯૯ (એક્ષ. ૬૮૪)				
૧૯	૩૪૧૨૩	ગોવિંદભાઈ પી. નાથી	પટાવાળા	૨૫૩૮૯૮૯૯ (એક્ષ. ૬૮૪)				
૨૦	૮૧૦૭૪	શ્રી પોપટલાલ જી. વાધેલા	પટાવાળા	૨૫૩૮૯૮૯૯ (એક્ષ. ૬૮૪)				

૨૧	૩૮૯૮૪	જસપાલ આર. રોત	પટાવાળા	૨૫૩૮૭૮૯૯ (એક્ષ. ૬૮૪)				
૨૨	૩૮૩૩૦	પોપટભાઈ બી. રાવળ	પટાવાળા	૩૨૫૨૦૮૪૫				

ઇન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાના અધિકારી/ કર્મચારીઓના માસિક મહેનતાણાંનું સ્ટેટમેન્ટ

અ.નં.	એમ્પલોઈ નં.	નામ	હોદ્દો	માસિક મહેનતાણું / પગાર	વળતર ભથ્યું	નીતિનિયમ મુજબ મહેનતાણું નક્કી કરવાની પદ્ધતિ
૧.	૮૩૭૫	ડૉ નરેન જી. હારી	લેબર ઓફિસર	૧૫૬૦૦-૨૮૧૦૦ (ગ્રેડ-પે ઇ૬૦૦)	કોર્પોરેશન દ્વારા વાહન ફાળવવામાં આવેલ છે.	નામ. આબીટ્રેટરના એવોઈ અન્યે તથા રાજ્ય સરકારના પગાર પંચ અન્યે પગાર ધોરણ રીવાઈઝ કરવામાં આવે છે.
૨.	--	હાલમાં જગ્ગા ખાતી	આરી. મેનેજર	--	--	“““““
૩.	૧૦૫૬	તુલસીદાસ એસ. રાઠવા	કો.ઓ. ઓફિસર	૮૩૦૦-૩૪૮૦૦ (૪૮૦૦)	“	“““““
૪.	૬૭૬૩	ગુલામનથી જી. શેખ	ડબલ્યુ. એલ. ઓ.	૮૩૦૦-૩૪૮૦૦ (૪૮૦૦)	“	“““““
૫.	૬૨૩૮	સતીષ સી. પટેલ	ડબલ્યુ. એલ. ઓ.	૮૩૦૦-૩૪૮૦૦ (૪૮૦૦)	“	“““““
૬.	૮૩૮૧	અમરીષ ડી. જાની	ડબલ્યુ. એલ. ઓ.	૮૩૦૦-૩૪૮૦૦ (૪૮૦૦)	“	“““““
૭.	૮૫૨૭	લક્ષ્મણભાઈ વી. ખાટા	ડબલ્યુ. એલ. ઓ.	૮૩૦૦-૩૪૮૦૦ (૪૬૦૦)	“	“““““
૮.	૮૭૦૫	દિલીપકુમાર સી. પંચાલ	ડબલ્યુ. એલ. ઓ.	૮૩૦૦-૩૪૮૦૦ (૪૬૦૦)	“	“““““
૯.	૪૮૫૬	વર્ષાબેન આર. ઓજા	ટાઈપીસ્ટ કમ કલાર્ક	૮૩૦૦-૩૪૮૦૦ (૪૬૦૦)	કન્વેઅન્સ એલાઉન્સ મળતું નથી.	“““““
૧૦.	૭૨૧૫૩	મહેશકુમાર બી.પારેખ	જુ.કો.ઓપરેટર	૫૨૦૦-૨૦૨૦૦ (૨૪૦૦)	“	“““““
૧૧.	૭૨૦૮૭	બિજેશકુમાર જી. નાયક	સ્ટેનો ગ્રાફિર	૮૩૦૦-૩૪૮૦૦ (૪૬૦૦)	“	“““““

૧૨.	૭૮૨૫	ભાનુપ્રસાદ જે.પટેલ	સીની. કલાર્ક	૬૩૦૦-૩૪૮૦૦ (૪૨૦૦)	"	*****
૧૩.	૭૬૭૨	મૌનાબેન એ. પંડીત	સીની. કલાર્ક	૬૩૦૦-૩૪૮૦૦ (૪૨૦૦)	"	*****
૧૪.	૬૮૪૮	શ્રી મયુરીબેન સી.પટેલ	સીની.કલાર્ક	૬૩૦૦-૩૪૮૦૦ (૪૨૦૦)	"	*****
૧૫.	૭૮૨૭	શ્રી ભીખાભાઈ એમ. પટેલ	સીની. કલાર્ક	૬૩૦૦-૩૪૮૦૦ (૪૨૦૦)	"	*****
૧૬.	૫૬૩૬	કમલેશ એચ. પુરોહિત	સીની. કલાર્ક	૬૩૦૦-૩૪૮૦૦ (૪૨૦૦)	"	*****
૧૭.	૫૩૮૨	શ્રી જેનીબેન બી. શાહ	જુની. કલાર્ક	૫૨૦૦-૨૦૨૦૦ (૨૪૦૦)	"	*****
૧૮.	૩૮૩૩૦	રાવળ પોપટભાઈ બી.	પટાવાળા	૪૪૪૦-૭૪૪૦ (૧૩૦૦)	"	*****
૧૯.	૩૮૧૮૨	જસપાલ આર. રોત	પટાવાળા	૪૪૪૦-૭૪૪૦ (૧૩૦૦)	"	*****
૨૦.	૩૪૦૬૨	રમણભાઈ પી. શર્મા	પટાવાળા	૫૨૦૦-૨૦૨૦૦ (૧૬૦૦)	"	*****
૨૧.	૩૪૧૨૩	ગોવિંદભાઈ પી. નાઈ	પટાવાળા	૫૨૦૦-૨૦૨૦૦ (૧૬૦૦)	"	*****
૨૨.	૬૧૦૭૪	પોપટલાલ જી. વાધેલા	પટાવાળા	૪૪૪૦-૭૪૪૦ (૧૬૪૦)	"	*****

- શ્રી લક્ષ્મણભાઈ વી. ખાટા, શ્રી મહેશકુમાર બી.પારેખ, શ્રી મયુરીબેન સી.પટેલ, શ્રી વર્ષાબેન આર. ઓજા તથા શ્રી જેની બી. શાહનો પગાર આઈ.આર. ખાતેથી નીકળતો નથી.

સફાઈ કામદારોના વારસદારોને રહેમરાહે નોકરી આપવા માટેના નિયમો

(૧)	નિયમોનું નામ	સફાઈ કામદારો, રેફયુઝ તથા ખાળુંવા ખાતાના કામદારોને મરણ તથા નોકરી દરમ્યાન અનફીટ થાય તો તેના વારસદારને રહેમરાહે નિમણૂક આપવી
(૨)	દસ્તાવેજનો પ્રકાર	(૧) સ્ટે.કમિટી ઠરાવ નં. ૧૨૮૬, તા. ૧૮.૧.૦૬ (૨) ભ્યુ.કો.ઠરાવ નં. ૧૦૮૩, તા. ૧૮.૧.૦૬ (૩) રહેમરાહે નોકરી આપવાના નિયમો પરિશાષ-એ (૪) ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતુ, સરક્યુલર નં. ૧, તા. ૨૮.૬.૦૬ (૫) ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતુ સરક્યુલર નં. ૧, તા. ૧૧.૬.૦૮ (૬) પ્પ વર્ષનો સરક્યુલર તા. ૧૮.૫.૨૦૧૦
(૩)	વારસદારની નોકરીના નિયમોની નકલ કયાંથી મળી શકશે	લેબર ઓફીસર ઇન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતુ ફોન નં. ૨૫૩૮૧૮૧૧ EPBX- ૫૪૬, ૪૧૮

નિર્ણય લેવામાં અનુસરવામાં આવતી પદ્ધતિ

ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાના ગ્રાં વિભાગો (૧) એસ્ટાબ્લીસમેન્ટ (૨) લેબર-વેલ્કર તથા (૩) ખાતાકીય તપાસ વિભાગમાં નિર્ણય લેવા માટે ફાઈલ નીચેના કમમાં મુકવામાં આવે છે.

(૧) એસ્ટાબ્લીસમેન્ટ -	<input type="checkbox"/> જુનિ. કલાર્ક	<input type="checkbox"/> સીની. કલાર્ક	<input type="checkbox"/> આસી. મેનેજર આઈ.આર.	<input type="checkbox"/> લેબર ઓફિસર	<input type="checkbox"/> ઇ. મુનિ. કમિશર આઈ.આર.
(૨) લેબર વેલ્કર ઓફિસર (વારસદારની નિમણૂંક કરવી)	<input type="checkbox"/> W.L.O.	<input type="checkbox"/> આસી. મેનેજર આઈ.આર.	<input type="checkbox"/> લેબર ઓફિસર	<input type="checkbox"/> ડાયરેક્ટર (એસડબલ્યુએમ)	
(૩) ખાતાકીય તપાસ વિભાગ	<input type="checkbox"/> ઈન્કવાયરી ઓફિસર	<input type="checkbox"/> સંકલન અધિકારી આઈ.આર.	<input type="checkbox"/> લેબર ઓફિસર	<input type="checkbox"/> ઇ. મુનિ. કમિ.(પશ્ચિમજોન/એસ્ટેટ)	
	<input type="checkbox"/> આસી. મેનેજર આઈ.આર.	<input type="checkbox"/> લેબર ઓફિસર		<input type="checkbox"/> ઇ. મુનિ. કમિ.(નાશાં/આઈ.આર.)	
				<input type="checkbox"/> ઇ. મુનિ. કમિ.(નવા પશ્ચિમ/સેન્ટ્રલ વર્કશૉપ)	
				<input type="checkbox"/> ઇ. મુનિ. કમિ. (વહિવટ/ટેક્ષ)	
				<input type="checkbox"/> ઇ. મુનિ. કમિ. (મધ્યજોન/ હોસ્પિટલ)	
				<input type="checkbox"/> ઇ. મુનિ. કમિ.. (પૂર્વજોન/ યુ.સી.ડી.)	
				<input type="checkbox"/> ઇ. મુનિ. કમિ. (ઉત્તરજોન/બગીચા)	
				<input type="checkbox"/> ઇ. મુનિ.કમિ. (દક્ષિણજોન/હેઠ્ય)	<input type="checkbox"/> મુનિ. કમિશર

મ્યુનિસિપલ કર્મચારીઓ / અધિકારીઓ સામેની પેન્ડિંગ ખાતાકીય તપાસ

(૩૦-૪-૧૫ ની સ્થિતિ)

નં.	ઈન્કવાયરી ઓફિસરનું નામ	ઇન્કવાયરી ઓફિસરનું નામ દરમાન નિકાલ કરેલ ખાતાકીય તપાસ	હાલ પેન્ડિંગ ખાતાકીય તપાસ	હાલ પેન્ડિંગ ખાતાકીય તપાસ					
				૫ વર્ષથી વધુ	૪ વર્ષથી વધુ	૩ વર્ષ સુધીની	૨ વર્ષ સુધીની	૧ વર્ષ સુધીની	૭ માસ સુધીની
૧	શ્રી એસ.કે. ટાકર અ.મ્યુ.કો.નિવૃત્ત લેબર કમ વેલ્ડેર ઓફિસર	૨૦	૨૬	૦૧	-	૦૩	૦૨	૦૪	૧૬
૨	શ્રી એસ.એન.શુક્લ રાજ્ય સરકારના નિવૃત્ત અધિકારી	૪૭	૧૬	૦૨	--	--	૦૧	૦૪	૦૮
૩	શ્રી વીપીનચંદ્ર એમ.જૈન રાજ્ય સરકારના નિવૃત્ત અધિકારી	૦૦	૦૦	--	--	--	--	--	૦૦
૪	શ્રી એલ.એ.શાહ રાજ્ય સરકારના નિવૃત્ત અધિકારી	૧૬	૧૫	-	--	૦૧	૦૧	૦૧	૧૨

ઇન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાનું મંજુર થયેલ બજેટ

(હજારમાં)

ગીપાર્ટમેન્ટ / एકાઉન્ટ કોડ	ખાતું તથા એકાઉન્ટ હેડનું નામ	૨૦૧૨-૧૩	૨૦૧૩-૧૪	૨૦૧૪-૧૫	૨૦૧૫-૧૬
૧૦૭ ૩૦૧૮૮	ઇન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતું ૫૦૨ ખર્ચ	૭૩૧૫	૮૧૮૧	૮૨૦૫	૧૧૫૨૧
૩૦૪૦૧	યુનિફોર્મ	૦૩	૦૭	૧૪	૧૪
૩૪૧૦૧	ટેલીફોન તથા ટ્રાંક્ટોલ (ઓફિસ)	૧૦૦	૮૦	૧૦૦	૧૦૦
૩૪૧૦૨	પોસ્ટેજ તથા ટેલીગ્રામ	૧૫	૧૫	૧૫	૧૫
૩૪૪૦૧	સ્ટેશનરી	૭૦	૭૦	૭૦	૧૦૦
૩૪૪૦૪	પ્રિન્ટિંગ	૧૦	૧૦	૧૦	૫૦
૩૪૪૦૫	એરોક્ષ	૩૦	૩૦	૩૦	૪૦
૩૪૪૦૮	પુસ્તકો, અખબારો અને સામયિકો	૦૮	૦૮	૦૮	૦૮
૩૪૮૮૮	અન્ય ખર્ચ	૬૫	૬૫	૬૫	૬૫

એપેલેટ અધિકારી તથા જાહેર માહિતી અધિકારીની વિગતો

નં.	નામ	હોદ્દો	ફોન નંબર			ફેક્સ	ઈ-મેઇલ	સરનામું
			ઓફિસ	મોબાઇલ	ઘર			
1.	ડૉ નરેન શ. હજારી	એપેલેટ અધિકારી	૨૫૭૮૯૮૯૯ એક્ષ. ૫૪૬	૯૭૨૭૦૩૮૭૭૩	૦૭૯- ૨૫૩૮૪૭૪૪	--	narenhajari @egovamc .com	ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતું, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ૧લો માળ, સરદાર પટેલ ભવન, મધ્યસ્થ કચેરી, દાણાપીઠ, અમદાવાદ
2.	શ્રી ગુલામનબી જ. શેખ	જાહેર માહિતી અધિકારી	૨૫૭૮૯૮૯૯ એક્ષ. ૪૧૮	૯૭૨૮૩૮૫૫૬૪	--	--	--	ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતું, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ૧લો માળ, સરદાર પટેલ ભવન, મધ્યસ્થ કચેરી, દાણાપીઠ, અમદાવાદ